

અરજદારની BNS ૪૯૭ અને ૫૦૩ મુજબની અરજી લગત ફુકમ
શ્રી SAKIR MUSHTAQ SHAIKH ની ફાલની અરજી વગર લીધી. અરજદાર તથા વિધવાન એ.પી.વી.શ્રી ને સાબાળ્યા, રજુ દસ્તાવેજો ધ્યાને લીધા. તપાસ
અમલદારની અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.

ફાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે, તેઓ અરજી માં જણાવ્યા મુજબના સરનામે ફાલમાં રહે છે તથા તેઓની સાથે સાયબર
ક્રાઇમનો બનાવ બનેલ જે બનાવમાં તેઓના Kotak Mahindra Bank ની ખાતા નંબર. 3911212449 (02) Bank of Baroda ની ખાતા નં-21850100022631 (03) HDFC
ખાતા નંબર. 00014153000353111થી રૂ.303060/- ઉપરી ગણેલ ફાલ. જે બાબતે તેઓએ સાયબર ક્રાઇમ ફેડરલ લાઈન નંબર 1930/100 ઉપર ફોન કરીને ફરીયાદ
નોંધાવેલ હતી. જે ફરીયાદ તારીખ 24/07/2024 ની રોજ રિક્ષિટ નંબર 31107240112688 થી નોંધાયેલ હતી. જે સબબ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તેઓના ગયેલ
નાણાં પૈકી સામાનાણાંઓના ખેંચોળા અપગ અપગ ખાતા નંબર માં રૂ. 35492/- રૂપિયા બી.એન.એસ.એસ.ની કલમ 105 મુજબ ફીઝ કરાવેલ હતા

અ.નં	બેંકનું નામ	ખાતા નંબર	ફીઝ રકમ
1	Axis Bank	923020060382508	20000/-
2	Axis Bank	923020047806034	15492/-

જે ફાલ સુધી સદર બેન્કમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે, આ બાબતે એફ.આઇ.આર. થયેલ નથી. તેઓને
મુબજ મોટું આર્થિક નુકસાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર ફાળીયાની જરૂર હોય સદર નાણાં તેઓના ખાતામાં પરત આપવા માટે BNS ૪૯૭
અને ૫૦૩ મુજબ ચોક્કસ ફુકમ થવા અરજ કરેલ છે.

(૨) અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર લાલગેટ પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓને સદર ગુના બાબતે તમામ પેપર
સહિત સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવા ફુકમ કરવામાં આવેલ.

જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર અડવા પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓએ તેઓની અભિપ્રાય રજુ કરેલ છે. તપાસ કરનાર અમલદારની અભિપ્રાય તથા
લગત કાગળો ધ્યાને લેતા તેઓએ જણાવેલ છે કે, સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાણાં જ્યારે ઓનલાઇન ટ્રાન્સફર થઈ જતા હોય છે ત્યારે આવા નાણાંને તાત્કાલીક
રોકવા તથા ગુના અટકાવવા માટે ભારત સરકાર દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ ફેડરલ લાઈન સામાન્ય નાગરીકો માટે શરૂ કરવામાં આવેલ છે. જે
ફાલ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઈડી ક્રાઇમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અને આ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ ઇન્સ્ટિટ્યુટ રીસ્પોન્સ યુનિટમાં સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર
નાણાં જ્યારે ઓનલાઇન ટ્રાન્સફર થઈ જતા હોય છે તેને તાત્કાલીક રોકવાની કામગીરી કરવામાં આવે છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરીકો સીધી જ પોતાની
ફરીયાદ હેલ્પ લાઈન નંબર ૧૦૦/૧૯૩૦ પર ડાયલ કરીને લખાવે છે ત્યારે ઇન્સ્ટિટ્યુટ રીસ્પોન્સ યુનિટ દ્વારા એક ટીકીટ નંબર આપવામાં આવે છે તેમજ સાથેસાથ જે
શંકાસ્પદ બેન્ક ખાતામાં જે-તે નાગરીકના નાણાં ગયેલ હોય તે બેન્ક ને નાણાં ફીઝ કરાવવા તેમજ જો નાણાં ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયેલ હોય તો તેની માફિતી આપવા
માટે તેઓની કચેરીએથી બી.એન.એસ.એસ.ની કલમ ૯૪ તથા ૧૦૬ મુજબ ફેડરલ નોટીસ આપવામાં આવે છે. નોટીસ આધારે બેન્કો દ્વારા આ શંકાસ્પદ રીતે મેળવાયેલ
નાણાં ફીઝ કરવામાં આવે છે.

વધુમાં અરજદારની અરજીની હકિકતો જણાવી વાદગુસ્ત રકમ બી.એન.એસ.એસ.ની કલમ ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણાં પાછા પેંચવા માટે
અરજદારશ્રીએ આંખ નામેદાર સાહેબની કોઠેમાં અરજી કરેલ હોય અને તે સાડુ તેઓની અભિપ્રાય માંગેલ છે. જે બાબતે તેઓએ જણાવેલ છે કે, જે ખાતા માં રૂપિયા ફીઝ
થયેલ છે જે સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાઈ આવેલ છે તથા સદર ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે
તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી જેથી તે રૂપિયા અરજદારશ્રી ને પાછા આપવા તેઓની અભિપ્રાય થાય છે.

(૩) સદર કામે અરજી સાથે રજુ કરવામાં આવેલ બેન્ક પેપરસની નકલ ધ્યાને લેતા તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા રજુ કરવામાં આવેલ અભિપ્રાય તથા તેને લગત
કાગળો ધ્યાને લેતા ફરીયાદીના ખાતામાંથી નાણાં ઉપડી ગયેલ હોવાનું તથા શંકાસ્પદ બેન્કના ખાતામાં ટ્રાન્સફર થયાનું ફાલના તબક્કે સ્પષ્ટ જણાઈ આવે છે.
તદુપરાંત રેકર્ડ પરની હકીકત ધ્યાને લેતા ફાલના કામે આજદીન સુધી કોઈ એફઆઇઆર થયેલ હોય કે ફાલના કામે કોઈની ધરપકડ કરવામાં આવેલ હોય તેમ જણાઈ
આવતું નથી તેમજ બનાવ બન્યે આટલી લાંબી સમય પસાર થયેલ હોવા છતાં આજદીન સુધી અરજદાર સિવાય અન્ય કોઈએ સદર નાણાંની અત્રેની અદાલત સમક્ષ
માંગણી કરતી કોઈ અરજી કરેલ નથી. તદુપરાંત તપાસ કરનાર અમલદારની અભિપ્રાય ધ્યાને લેતાં તેઓ સમક્ષ પણ કોઈએ આ નાણાંની માંગણી કરેલ હોય તેમ
જણાતું નથી. તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાવેલું છે તથા સદર ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ
વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી. જેથી તપાસ કરનાર અમલદાર દ્વારા સદર નાણાં અરજદારશ્રીને પાછા આપવા
સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. જેથી અત્રેની અદાલતના માનવા મુજબ ફાલના અરજદાર સદર નાણાંનો કબ્જો મેળવવા હકદાર હોવાનું જણાય છે.

(૪) આ તબક્કે સદર નાણાં પરત આપવા બાબતે અત્રેની અદાલતની સત્તા હકુમતે જોતા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ની કલમ ૪૫૭ માં નીચે મુજબ જોગવાઈ
કરવામાં આવેલ છે.

કલમ- ૪૫૭

કોઈ પોલીસ અધિકારીએ મિલકત કબ્જે લીધાનો આ અધિનિયમની જોગવાઈ ફેડરલ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરવામાં આવે અને તપાસ કે ઇન્સાફી કાર્યવાહી
દરમ્યાન ફોજદારી ન્યાયાલય સમક્ષ તે મિલકત રજુ ન કરવામાં આવે ત્યારે, મિલકતના નિકાલ સંબંધી અથવા તેનો કબ્જો ધરાવવા હકદાર વ્યક્તિને તે
મિલકત સોંપી દેવા સંબંધી અથવા તે વ્યક્તિ અંગે ખાતરી કરી જાણી ન શકાય તો, તે મિલકતની કબ્જી અને તેને રજુ કરવા સંબંધમાં મેજિસ્ટ્રેટ પોતાને ચોક્કસ
લાગે તે ફુકમ કરી શકશે.

આમ સદર કાયદાકીય જોગવાઈ મુજબ જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી દ્વારા મિલકતની જપ્તીની જાણ મેજિસ્ટ્રેટને કરવામાં આવે અને
તપાસ દરમ્યાન આવી મિલકત અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલ ન હોય ત્યારે મેજિસ્ટ્રેટ ને આવી મિલકતના નિકાલ અથવા તો કબ્જા બાબતે ચોક્કસ લાગે તેવો
ફુકમ કરવાની સત્તા આપવામાં આવે

આમ ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતાં સદર નાણાં બેન્ક માં જમા હોય તેથી સદર
રેકર્ડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમજ બંધિયો પણ મુદ્દામાલ ની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય
તેમ નથી. વધુમાં આદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સુદરસાઈ સંબંધી લાલ દેસાઈ બિ. ગુજરા રાજ્ય, ૨૦૦૩(૧) જી. એલ. એચ. પાના નંબર ૩૦૭ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો
ધ્યાને લેતાં પણ ઉપરોક્ત જણાવેલ કારણોસર ફાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો ફુકમ કરવા માં આવે છે.

ફુકમ

- અરજદારશ્રી SAKIR MUSHTAQ SHAIKH ની અરજી આથી BNS કલમ ૫૦૩ ફેડરલ આથી મંજૂર કરવામાં આવે છે.
- અરજદારને સદર ગુનાના કામે અલગ અલગ બેન્કોમાં સીઝ કરવામાં આવેલ કુલ રોકડ રકમ રૂ. ૩૫૪૯૨/- પુરાની દોઢી રકમના જાત જામીન (બોન્ડ) તથા તેટલી
જ રકમના સધાર જામીન પોલીસ સ્ટેશનમાં આપેલી પરત સોંપવાનો ફુકમ કરવામાં આવે છે.

વધુમાં ફુકમ કરવામાં આવે છે કે, અરજદાર દ્વારા ફુકમ મુજબના જાત જામીન તથા સધાર જામીન પોલીસ સ્ટેશનમાં આપેલી પોલીસ અધિકારી દ્વારા તે મતલબની
જાણ તથા સદર ફુકમની જાણ ફરીયાદી તથા જેમાં નાણાં સીઝ થયેલ છે તે બેન્કને કરવી અને જે બેન્કમાં નાણાં ફીઝ થયેલ છે તે રકમ ૩૫૪૯૨/- અરજદાર ખાતુ
ધરાવતી બેન્ક Kotak Mahindra Bank ની ખાતા નંબર. 3911212449 માં જમા કરાવી અત્રેની અદાલતને જાણ કરવી.

- સદર તકરારી નાણાં બાબતે શંકાસ્પદ ખાતાના ધારક કોઈ કાર્યવાહી કરે તો અરજદારે સદર રકમ પરત જમા કરાવવી.

સુરત.

તારીખ:-

૧૪માં એડી. સીની. સિવિલ જજ અને

ચો.સી.જે.એમ., સુરત.

